



CHEMIESYNTH (VAPI) LIMITED

Regd office: Plot No. 27, GIDC, Phase-1, Vapi – 396195, Gujarat.

CIN: L24110GJ1986PLC008634, GST Reg no: 24AAACC9688H1ZC, Telephone no: 022-21010500,

Web: <https://www.chemiesynth.com> Email id: compliance@chemiesynth.com

Date: 15/11/2025

To,
The Listing Department/
Corporate Compliance Department,
BSE Limited
P.J. Tower,
Dalal Street,
Mumbai 400001.

Scrip Code: 539230.

SUB: Submission of Newspaper Advertisement regarding publication of Un-audited Financial Results for the Quarter and Half Year ended 30th September 2025.

Dear Sir/Madam,

This is to inform that pursuant to Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company had published there Un-audited Financial Results for the Quarter and Half Year ended as on 30th September 2025 which were approved in the Board meeting held on Friday 14th November 2025 in one English and Gujarati language newspaper.

The above advertisement was published on Saturday, 15th November, 2025. The details are as follows: -

- (1) Indian Express-English
- (2) Financial Express-Gujarati

Kindly take the above information on record.

Thanking You,

Yours Faithfully,
For **Chemiesynth (Vapi) Limited**

Pranali Dholabhai
Company Secretary & Compliance Officer

Place: Vapi, Gujarat.

Encl.: Copy of Newspapers.

| Chemiesynth (Vapi) Limited | | | | | | |
|--|---|-------------|-----------------|-------------|-------------|------------|
| Registered Office: Plot No. 27, GIDC, Vapi, Gujarat - 396 195, India. | | | | | | |
| Tel.: +91 260 7432085 Fax: +91 260 7432038 CIN: L2411(GJ)1968P.C00834 Email: compliance@chemiesynth.com | | | | | | |
| Extract of the un-audited standalone financial results for the Quarter & Half year ended September 30, 2025. | | | | | | |
| (Rs. in Lac, unless otherwise stated) | | | | | | |
| | Quarter Ended | | Half Year Ended | | Year Ended | |
| | 30/09/2025 | 30/09/2023 | 30/09/2024 | 30/09/2023 | 30/09/2024 | 31/03/2025 |
| (Refer Notes Below) | | | | | | |
| 1 | Total Income from Operations | (unaudited) | (unaudited) | (unaudited) | (unaudited) | (audited) |
| | 687.15 | 397.46 | 546.98 | 1084.61 | 832.22 | 1889.91 |
| 2 | Net Profit/(Loss) for the period (before Tax and Exceptional Items) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 |
| | -0.82 | | | | | |
| 3 | Net Profit/(Loss) for the period before Tax (after exceptional items) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 |
| | -0.82 | | | | | |
| 4 | Net Profit/(Loss) for the period after Tax (after Exceptional Items) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 |
| | -10.62 | | | | | |
| 5 | Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and other Comprehensive Income (after tax)) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 |
| | -35.99 | | | | | |
| 6 | Equity Share Capital | 307 | 307 | 307.00 | 307 | 307 |
| 7 | Earning per Equity Share: Basic and Diluted (Rs) | -1.43 | -1.49 | 1.36 | -2.92 | 0.57 |
| | -0.35 | | | | | |

Notes: 1. The Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable. 2. The above unaudited financial results have been reviewed by the audit committee and approved by the Board of Directors at its meeting held on Friday, 14th November 2025. The Statutory Auditors have carried out a limited review of the above financial results. 3. Results for the quarter & half year ended September 30, 2025, are in compliance with Indian Accounting Standard (Ind AS) in terms of SEBI's Circular bearing no CIR/CF/FA/62/2015 dated July 2016. 4. The results of the Company for the quarter and half year ended September 30, 2025, are available on the Company's Website - www.chemiesynth.com 5. Company Operates in only one business segment i.e. Chemical Manufacturing & Previous periods/year's figures have been regrouped wherever necessary.

On behalf of the Board of Directors

Sd/-

Sandip Zaveri, Managing Director

DIN: 00158876

Place: Vapi

Date: 14/11/2025

એમ્બી ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડ

CIN:L17120DN1994PLC000387

રજી.ઓફીસ: ૯૬/૨૧ અને ૨૮, સુભાષ રોડ, મુંબઈ-૪૦૦ ૦૩૭
 હયાત અને નવગ બેંકો દ્વારા ફેનડમેન્ટ પ્રદર્શન, ભિલવાડા-૩૬૨૫૩૦.

ફોન : +૯૧ ૨૨ ૪૭૨૨૫૫૫૫, ફેક્સ : +૯૧ ૨૨ ૪૭૯૯૦૯, ઈમેલ: info@emmbil.com | Website: www.emmbil.com

સેબી (સિસ્ટીંગ એગ્રીમેન્ટેશન અને ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ અન્વયે, ૨૦૨૫ના, જ્યારે પૂરા થતાં વિમાસિક અને છપાસિકના ચતુર્થાંક અનુચોડિટી નાણાંચિક વહીવટીઓનો સાર

[illegible]

| THE INDIAN WOOD PRODUCTS COMPANY LIMITED | | | | | | | | | | | | | |
|--|---------------|------------|-----------------|------------|------------|------------|---------------|------------|-----------------|------------|------------|------------|------------|
| CIN: L20101WB1919PLC003557 | | | | | | | | | | | | | |
| Regd Office: 9, Brabourne Road, Kolkata – 700 001 | | | | | | | | | | | | | |
| Email id: iwpho@iwpkatha.co.in, Website: www.iwpkatha.com, Phone: 033-22426799 | | | | | | | | | | | | | |
| STATEMENT OF UNAUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS | | | | | | | | | | | | | |
| FOR THE QUARTER/HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2025 | | | | | | | | | | | | | |
| (Rs. in lakhs) | | | | | | | | | | | | | |
| Particulars | STANDALONE | | | | | | CONSOLIDATED | | | | | | |
| | Quarter Ended | | Half Year Ended | | Year Ended | | Quarter Ended | | Half Year Ended | | Year Ended | | |
| | 30.09.2025 | 30.06.2025 | 30.09.2024 | 30.06.2024 | 30.09.2024 | 31.03.2025 | 30.09.2025 | 30.06.2025 | 30.09.2024 | 30.06.2024 | 30.09.2024 | 31.03.2025 | 31.03.2025 |
| | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited |
| Total Income From Operation | 5,533.02 | 5,149.14 | 6,008.69 | 10,682.16 | 11,649.42 | 22,635.94 | 5,533.02 | 5,149.14 | 6,008.69 | 10,682.16 | 11,649.42 | 22,635.94 | |
| Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary item) | 122.20 | 103.87 | 123.12 | 226.07 | 251.98 | 506.41 | 255.14 | 140.41 | 206.04 | 395.55 | 355.94 | 667.77 | |
| Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 122.20 | 103.87 | 123.12 | 226.07 | 251.98 | 506.41 | 255.14 | 140.41 | 206.04 | 395.55 | 355.94 | 667.77 | |
| Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 95.47 | 78.39 | 113.02 | 173.86 | 217.75 | 367.79 | 228.41 | 114.93 | 195.94 | 343.34 | 321.71 | 529.15 | |
| Total Comprehensive Income for the period (after tax) and Other Comprehensive Income (after tax) | 91.37 | 74.30 | 95.38 | 165.67 | 182.48 | 352.19 | 224.31 | 110.84 | 178.30 | 335.15 | 286.44 | 497.77 | |
| Equity Share Capital (Face Value Rs. 2/- each) | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | 1,279.75 | |
| Reserves excluding Revaluation reserve | - | - | - | - | - | 34,591.90 | - | - | - | - | - | 34,679.57 | |
| Earnings per share(Basis & Diluted) (Face value Rs. 2/- per share) | 0.15 | 0.12 | 0.18 | 0.27 | 0.34 | 0.57 | 0.36 | 0.18 | 0.31 | 0.54 | 0.50 | 0.83 | |

1) The aforementioned results of the company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on November 14, 2025 at Kolkata

2) The above is an extract of the detailed format of Quarterly/Half Yearly Result filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Half Yearly Results are available on the stock exchange's website i.e. www.bseindia.com and also the website of the Company i.e. www.iwpkatha.com

By Order of the Board
For The Indian Wood Products Co Ltd

Sd/-
Krishna Kumar Mohita
Chairman and Managing Director
(DIN : 00702306)

Place : Kolkata
Date : 14.11.2025

| LAST MILE ENTERPRISES LIMITED | | | | | | | | | |
|--|---|------------------------|------------|--------------------------|-------------|------------------------|------------|--------------------------|----------|
| (Formerly known as Trans Financial Resources Limited) | | | | | | | | | |
| 4 th , Floor Vaghela Avenue, Nr. Havmore Restaurant, Navrangpura, Ahmedabad-380009, Gujarat. E-MAIL: tfr14444@gmail.com • CIN:L70100GJ1994PLC022954 | | | | | | | | | |
| EXTRACT FROM THE STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30.09.2025 | | | | | | | | | |
| Sr. No. | Particulars | STANDALONE | | | | CONSOLIDATED | | | |
| | | Quarter ended Ended on | | Year Ended on 31-03-2025 | Rs. In Lacs | Quarter ended Ended on | | Year Ended on 31-03-2025 | |
| | | 30-09-2025 | 30-09-2024 | 30-09-2025 | | 30-09-2025 | 30-09-2024 | 30-09-2025 | |
| 1 | Total income from operations | 540.98 | 1069.91 | 981.65 | 4476.35 | 78773.87 | 3525.63 | 203003.56 | 40377.51 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 212.80 | 818.80 | 393.65 | 1399.10 | 407.55 | 1079.35 | 1239.26 | 2305.07 |
| 3 | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) | 212.80 | 818.80 | 393.65 | 1399.10 | 407.55 | 1079.35 | 1239.26 | 2305.07 |
| 4 | Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) | 158.22 | 768.80 | 294.57 | 1058.75 | 307.07 | 955.35 | 990.18 | 1795.43 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] | 158.22 | 768.80 | 294.57 | 1058.75 | 307.07 | 955.35 | 990.18 | 1795.43 |
| 6 | Equity Share Capital | 3533.31 | 2737.17 | 3533.31 | 3506.92 | 3533.31 | 2737.17 | 3533.31 | 3506.92 |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year | – | – | – | 33717.36 | – | – | – | 34376.33 |
| 8 | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) | | | | | | | | |
| | Basic : | 0.04 | 2.81 | 0.08 | 0.30 | 0.07 | 3.49 | 0.20 | 0.44 |
| | Diluted : | 0.04 | 2.81 | 0.08 | 0.30 | 0.07 | 3.49 | 0.20 | 0.44 |


Notes:

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.transfinancialrtd.com)

2. The result of the Quarter ended on 30th September, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 31.10.2024.

FOR, LAST MILE ENTERPRISES LIMITED
(Formerly Known As Trans Financial Resources Limited)
SD/-
Name of Signatory: HEMRAJSINH VAGHELA
Designation: DIRECTOR & CHAIRPERSON
DIN: 00287055

Place: Ahmedabad
Date:14.11.2025

| FAZE THREE LIMITED | | | | | | | | | |
|--|--|--|--|--|--|--|--|--|--|
| CIN No. L99999DN1985PLC000197 | | | | | | | | | |
| Website: www.fazethree.com E-mail : cs@fazethree.com Tel.: 022-43514444/400 | | | | | | | | | |
| Regd.Off.: Survey No. 380/1, Khanvel Silvassa Road, Village Dapada, Silvassa – 396 230, UT of D&NH | | | | | | | | | |
| EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF-YEAR ENDED SEPTEMBER 30, 2025 | | | | | | | | | |
| The Un-audited Financial Results (Standalone & Consolidated) of the Company for the second quarter and half-year ended September 30, 2025, were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on November 13, 2025. The Statement of Financial Results can be accessed by scanning the provided QR Code, additionally the same are available on the Company's website (URL:https://www.fazethree.com/investors/financial-results), on the website of BSE Limited (www.bseindia.com) and NSE Limited (www.nseindia.com) | | | | | | | | | |
|  | | | | | | | | | |
| By Order of the Board For Faze Three Limited Sd/- Ajay Anand Managing Director DIN:00373248 | | | | | | | | | |
| Place: Mumbai Date: November 13, 2025 | | | | | | | | | |

| BLOOM DEKOR LIMITED | | | | | | | | | |
|--|-----------------------------|---------|--------------------------|------------|-----------------------------|---------|--------------------------|---------|--|
| CIN: L20210GJ1992PLC017341 | | | | | | | | | |
| Regd. Office: Survey No. 275, At & Post: Dhanap, N. H. No. 8, Opp. Ambemata Temple, Gandhinagar – 382355, Gujarat, India. | | | | | | | | | |
| Corporate Office: 2/F, Sumel, S. G. Highway Road, Thaltej, Ahmedabad-380 059, Gujarat. | | | | | | | | | |
| Tel. Phone: +91 – 79 – 2684 1916 / 17; Fax: + 91 – 79 – 2684 1914; E-mail: redressal@bloomdekor.com; Website: www.bloomdekor.com | | | | | | | | | |
| UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON SEPTEMBER 30, 2025 | | | | | | | | | |
| (₹ in Lakh except EPS) | | | | | | | | | |
| Particulars | Quarter ended on 30/09/2025 | | Year ended on 31/03/2025 | | Quarter ended on 30/09/2024 | | Year ended on 30/09/2024 | | |
| | Unaudited | | Audited | | Unaudited | | Audited | | |
| Total Income From Operations | | 112.93 | | 456.14 | | 133.64 | | 133.64 | |
| Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | | (24.33) | | (138.44) | | (21.17) | | (21.17) | |
| Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | | (24.33) | | (138.44) | | (21.17) | | (21.17) | |
| Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | | (18.16) | | (103.45) | | (17.61) | | (17.61) | |
| Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | | (18.16) | | (103.36) | | (17.61) | | (17.61) | |
| Equity Share Capital | | 685.00 | | 685.00 | | 685.00 | | 685.00 | |
| Reserves (excluding Revaluation Reserve as per the audited Balance Sheet of the previous year) | | – | | (1,342.56) | | – | | – | |
| Earnings Per Share (for continuing and discontinued operations)- | | | | | | | | | |
| Basic: (not annualized for the quarter ended) | | (0.27) | | (1.51) | | (0.26) | | (0.26) | |
| Diluted: (not annualized for the quarter ended) | | (0.27) | | (1.51) | | (0.26) | | (0.26) | |

Notes:- The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Website of BSE Limited at www.bseindia.com and Company's website at www.bloomdekor.com.

Sd/-
Dr. Sunil Gupta
Suspended Managing Director
DIN: 00012572
Place: Ahmedabad

For, Bloom Dekor Limited
Sd/-
CA Vineeta Maheshwari
RP for Bloom Dekor Limited- in CIRP
IBBI/PA-001/IP-P00185/2017-2018/10364
Place: Surat

Date: 14/11/2025

| NMDC Limited | | | | |
|---|----------|------------------------|---|--|
| (A Govt. of India Enterprise) | | | | |
| 'Khanji Bhavan', 10-3-311/A, Castle Hills, Masab Tank, Hyderabad-500028. CIN : L43100TG1958GOI001674 | | | | |
| E-MAIL : kvprakash@nmdc.co.in ; jvenkatesan@nmdc.co.in | | | | |
| OPEN TENDER NOTICE(E-Procurement Mode Only) | | | | |
| Tender No : NMDC/HO/MM/PURCH/PP/2025/22MSTC Ref no: NMDC/Head Office/Material Management/1/25-26/ET/476 Dtd. 13.11.2025 | | | | |
| E-tenders are invited for following items from reputed manufacturers directly or through their dealers / accredited agents through MSTC portal website https://www.mstcecommerce.com/eprochome/nmdc/buyer_login.jsp. | | | | |
| Description | Qty (No) | Pre Bid Meeting | Display & sale of tender Documents Period | Last date & time for submission of offer |
| Supply and E & C of 01 no.,Hydraulic Backhoe Excavator of 3.5 to 4.00 CuM Capacity,derated to 3.2 to 3.6 CuM bucket capacity for Panna project under COST CAP agreement for 6 years / 12000 hours (whichever is earlier). | 01 | 24/11/2025 at 03.30 PM | 08/12/2025 to 29/12/2025 | 29/12/2025 by 02.30 PM (IST) |
| Prospective bidders may visit our websites: www.nmdc.co.in; CPP Portal https://eprocure.gov.in; https://mstcecommerce.com and may download the tender documents. Any corrigendum to the above tender notice will be uploaded on our website and MSTC e-portal only. | | | | |
| General Manager (Materials) | | | | |

| ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES, Phulwarisharif, PATNA - 801507 | |
|--|--|
| PUBLIC NOTICE | |
| AIIMS Patna plans to dispose inpatient medical records from 2014-18 and 2020-21, those interested in obtaining their records are requested to collect them from Medical Record Department within one month from the date of advertisement. | |
| -By order | |


| ADITYA ULTRA STEEL LIMITED | | | | | | | | | |
|--|------------------------------------|----------|-------------------------------|-----------|--|--|--|--|--|
| CIN: L27100GJ2011PLC066552 | | | | | | | | | |
| Reg. Office & Factory: Survey No-48, Wankamer Boudry, Bhalgam, National Highway 8-A, Wankaner, Rajkot, Wankaner, Gujarat, India, 363621. | | | | | | | | | |
| Email ID: cs@aditya-ultra-steel.com Phone: 6357585716 Website: www.aditya-ultra-steel.com | | | | | | | | | |
| EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2025 | | | | | | | | | |
| (₹ In Lakhs) | | | | | | | | | |
| Particulars | For the Half-year ended 30/09/2025 | | For the Year Ended 31/03/2025 | | | | | | |
| | Unaudited | | Audited | | | | | | |
| | 18447.03 | | 58,531.72 | | | | | | |
| Total Income from operations (net) | | 18447.03 | | 58,531.72 | | | | | |
| Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extra Ordinary items) | | 60.46 | | 1,108.93 | | | | | |
| Net profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | | 60.54 | | 932.89 | | | | | |
| Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | | 60.54 | | 932.89 | | | | | |
| Equity Share Capital | | 2,483.56 | | 2,483.56 | | | | | |
| Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous year) | | 6441.08 | | 6,380.83 | | | | | |
| Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - | | | | | | | | | |
| (a) Basic | | 0.24 | | 4.36 | | | | | |
| (b) Diluted | | 0.24 | | 4.36 | | | | | |

Note : 1. The above is an extract of the detailed format of Half year ended on 30th September, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half Year ended Financial Results are available on the Stock Exchange website i.e. www.nseindia.com and on the website of the Company i.e. www.aditya-ultra-steel.com. Scan QR Code for full Financial Results alongwith auditor's report.

2. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 14th November, 2025. 3. Figures for the previous periods have been regrouped/ reclassified/ restated wherever necessary.

FOR AND ON BEHALF OF THE BOARD
ADITYA ULTRA STEEL LIMITED
SUNNY SUNIL SINGHI
Managing Director
(DIN 07210706)

Date: 14th November, 2025
Place : Ahmedabad



| Chemiesynth (Vapi) Limited | | | | | | | | | |
|---|---------------|-------------|-----------------|-------------|-------------|------------|--|--|--|
| Registered Office: Plot No. 27, GIDC, Vapi, Gujarat - 396 195, India. | | | | | | | | | |
| Tel.: +91 260 2432885 Fax: +91 260 2432036 CIN: L24110GJ1986PLC008634 Email: compliance@chemiesynth.com | | | | | | | | | |
| Extract of the un-audited standalone financial results for the Quarter & Half year ended September 30, 2025. | | | | | | | | | |
| (Rs. In Lac, unless otherwise stated) | | | | | | | | | |
| | Quarter Ended | | Half year Ended | | Year Ended | | | | |
| | 30/09/2025 | 30/06/2025 | 30/09/2024 | 30/09/2025 | 30/09/2024 | 31/03/2025 | | | |
| (Refer Notes Below) | (unaudited) | (unaudited) | (unaudited) | (unaudited) | (unaudited) | (audited) | | | |
| 1 Total Income from Operations | 687.15 | 397.46 | 546.98 | 1084.61 | 832.22 | 1889.91 | | | |
| 2 Net Profit/(Loss) for the period (before Tax and Exceptional Items) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 | -0.82 | | | |
| 3 Net Profit/(Loss) for the period before Tax (after exceptional items) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 | -0.82 | | | |
| 4 Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items) | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 | -10.62 | | | |
| 5 Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax) and other Comprehensive Income (after tax)] | -43.95 | -45.63 | 41.80 | -89.58 | 17.45 | -35.99 | | | |
| 6 Equity Share Capital | 307 | 307 | 307.00 | 307 | 307 | 307 | | | |
| 7 Earning per Equity Share: Basic and Diluted (Rs) | -1.43 | -1.49 | 1.36 | -2.92 | 0.57 | -0.35 | | | |

Notes: 1. The Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable. 2. The above unaudited financial results have been reviewed by the audit committee and approved by the Board of Directors at its meeting held on Friday, 14th November 2025. The Statutory Auditors have carried out a limited review of the above financial results. 3. Results for the quarter & half year ended September 30, 2025, are in compliance with Indian Accounting Standard (Ind AS) in terms of SEBI's Circular bearing no CIR/CFD/FAC/62/2015 dated July 2016. 4. The results of the Company for the quarter and half year ended September 30, 2025, are available on the Company's Website - www.chemiesynth.com 5. Company Operates in only one business segment i.e. Chemical Manufacturing 6. Previous periods/year's figures have been regrouped wherever necessary.

On behalf of the Board of Directors
Sd/-
Sandip Zaveri, Managing Director
DIN: 00158876

Place: Vapi
Date: : 14/11/2025

| JAMNAGAR UTILITIES & POWER PRIVATE LIMITED | | | | | | |
|--|---|---------------|------------|------------|------------|--|
| Registered Office: CPP Control Room, Village Padana, Taluka Lalpur, District Jamnagar - 361 280, Gujarat | | | | | | |
| Phone: 022-35557100 • Email: debenture_investors@jupl.co.in | | | | | | |
| Website: www.jupl.co.in • CIN: L40100GJ1991PTC051130 | | | | | | |
| EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER 2025 | | | | | | |
| (Rs. In crore, except per share data and ratios) | | | | | | |
| Sr. No. | Particulars | Quarter Ended | | Year Ended | | |
| | | 30 Sep '25 | 30 Sep '24 | 31 Mar '25 | 31 Mar '24 | |
| | | Unaudited | Unaudited | Audited | Audited | |
| 1 | Total Income from Operations | 1,147.17 | 1,149.64 | 4,657.48 | | |
| 2 | Net Profit before Exceptional Item and Tax | 611.40 | 202.47 | 1,360.84 | | |
| 3 | Net Profit before Tax (after Exceptional Item) | 1,149.69 | 202.47 | 1,360.84 | | |
| 4 | Net Profit after Tax | 900.59 | 186.55 | 717.48 | | |
| 5 | Total Comprehensive Income (Comprising Profit (after tax) and Other Comprehensive Income / (Loss) (OCI) (after tax)) | 253.01 | 252.25 | 336.53 | | |
| 6 | Paid up Equity Share Capital | 2,720.69 | 2,720.69 | 2,720.69 | | |
| 7 | Reserves (excluding Revaluation Reserve) | | | 23,866.40 | | |
| 8 | Securities Premium Account | | - | - | | |
| 9 | Net worth | 28,789.54 | 25,554.94 | 26,861.86 | | |
| 10 | Paid up Debt Capital / Outstanding Debt | 16,412.77 | 16,503.80 | 16,435.21 | | |
| 11 | Outstanding Redeemable Preference Shares | 5,000.00 | 5,000.00 | 5,000.00 | | |
| 12 | Debt Equity Ratio | 0.57 | 0.63 | 0.62 | | |
| 13 | Earnings Per Share (EPS) for the period / year - Class 'B' Equity Shares of face value of Rs. 1 each - Basic and Diluted (In Rupees) - After Exceptional Item | 0.33 | 0.07 | 0.26 | | |
| | - Basic and Diluted (In Rupees) - Before Exceptional Item | 0.13 | 0.07 | 0.26 | | |
| 14 | Capital Redemption Reserve | - | - | - | | |
| 15 | Debenture Redemption Reserve | 935.00 | 935.00 | 935.00 | | |
| 16 | Debt Service Coverage Ratio | 2.45 | 0.24 | 0.81 | | |
| 17 | Interest Service Coverage Ratio | 2.62 | 1.53 | 1.90 | | |

Notes:

1) The above is an extract of the detailed format of the Unaudited Standalone Financial Results for the quarter and half year ended 30th September 2025 filed with the Stock Exchange under Regulation 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended 30th September 2025 are available on the website of BSE Limited (www.bseindia.com) and can be accessed on the Company's website (www.jupl.co.in).

2) For the other items referred in Regulation 52(4) of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to BSE Limited (www.bseindia.com) and can be accessed on the Company's website (www.jupl.co.in).

3) The Audit Committee has reviewed, and the Board of Directors has approved the above results and its release at their respective meetings held on 14th November 2025. The statutory auditors have carried out a limited review on the aforesaid results.

For Jamnagar Utilities & Power Private Limited
Sd/-
Satish Parkh
Chairman
DIN: 00490560

Date : 14th November 2025
Place : Mumbai